

રીજર્વ બેંક – ઈન્ટીગ્રેટેડ ઓમ્બડસમેન(લોકપાલ) સ્કીમ, ૨૦૨૧

### મુખ્ય વિશેષતાઓ

ધી ઈન્ટીગ્રેટેડ ઓમ્બડસમેન(લોકપાલ) સ્કીમ, ૨૦૨૧ તા. ૧૨/૧ ૧/૨૦૨૧ થી અમલમાં છે.  
સદર સ્કીમની પ્રસિધ્ધી સાથે, ધી ઈન્ટીગ્રેટેડ ઓમ્બડસમેન(લોકપાલ) સ્કીમ, ૨૦૨૧ માં અગાઉની  
યોજનાઓ જેવી કે, (૧) બેંકિંગ ઓમ્બડસમેન સ્કીમ, ૨૦૦૬, (૨) ધી ઓમ્બડસમેન સ્કીમ ફોર  
નોન-બેંકિંગ ફાયનાન્સીયલ કંપનીઝ, ૨૧૦૮ અને (૩) ધી ઓમ્બડસમેન સ્કીમ ફોર ડીજીટલ  
ટ્રાન્ઝેક્શન, ૨૦૧૯ રદ કરવામાં આવી છે.

ધી ઈન્ટીગ્રેટેડ ઓમ્બડસમેન(લોકપાલ) સ્કીમ, ૨૦૨૧ ની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

૧. ફરીયાદ આ સ્કીમ હેઠળ લાગુ પડશે નહીં સિવાય કે,

એ) ફરીયાદીએ આ સ્કીમ હેઠળ ફરીયાદ કરતા પહેલા જે તે રેઝ્યુલેટેડ એન્ટીટીને  
લેખિતમાં ફરીયાદ કરી હોય અને

૧. રેઝ્યુલેટેડ એન્ટીટી ધ્વારા ફરીયાદને સંપૂર્ણ અથવા આંશિક રીતે નકારી કાઢ  
વામાં આવી હોય અને ફરીયાદી જવાબથી સંતુષ્ટ ન હોય અથવા રેઝ્યુલેટેડ  
એન્ટીટીને ફરીયાદ મળ્યા પછી ૩૦ દિવસની અંદર ફરીયાદીને કોઈ જવાબ  
ન મળ્યો હોય અને

૨. ફરીયાદીને રેઝ્યુલેટેડ એન્ટીટી તરફથી ફરીયાદનો જવાબ મળ્યા બાદ એક  
વર્ષની અંદર અથવા જયારે કોઈ જવાબ મળ્યો ન હોય ત્યારે ફરીયાદની  
તારીખથી એક વર્ષ અને ૩૦ દિવસ બાદ ફરીયાદ ઓમ્બડસમેન  
(લોકપાલ)ને કરેલ હોય.

બી) ફરીયાદ એ જ કોર્ઝ ઓફ એક્શનના સંદર્ભમાં ન હોવી જોઈએ, જે અગાઉ

૧. ઓમ્બડસમેન (લોકપાલ) સમક્ષ પડતર હોય અથવા લોકપાલ ધ્વારા  
યોગ્યતાના આધારે પતાવટ થયેલ હોય અથવા કાર્યવાહી કરવામાં આવી  
હોય, પછી ભલે તે એ જ ફરીયાદી પાસેથી અથવા એક અથવા વધુ

ફરીયાદીઓ સાથે અથવા સંબંધિત પક્ષકારોમાંથી એક અથવા વધુ પાસેથી મળી હોય.

2. કોઈપણ કોર્ટ, ટ્રીબ્યુનલ કે આર્બિટ્રેટર અથવા અન્ય કોઈ ફોરમ અથવા ઓથોરીટી સમક્ષ પડતર હોય અથવા લોકપાલ ધ્વારા યોગ્યતાના આધારે પતાવટ થયેલ હોય અથવા કાર્યવાહી કરવામાં આવી હોય, પછી ભલે તે એ જ ફરીયાદી પાસેથી અથવા એક અથવા વધુ ફરીયાદીઓ સાથે અથવા સંબંધિત પક્ષકારોમાંથી એક અથવા વધુ પાસેથી મળી હોય.
- (સી) ફરીયાદ અપમાનજનક કે વ્યર્થ ઉત્તેજક પ્રકૃતિની ન હોય,
  - (ડી) જે તે દાવાઓ માટે સમયમર્યાદા અધિનિયમ, ૧૯૬૩ હેઠળ નિર્ધારિત મર્યાદાની મુદ્દત પૂરી થાય તે પહેલા રેંયુલેટેડ એન્ટીટીને ફરીયાદ કરવામાં આવી હોય,
  - (ઇ) ફરીયાદી સંદર્ભ સ્કીમની કલમ-૧૧ માં નિર્દિષ્ટ કર્યા મુજબ સંપૂર્ણ માહીતી પૂરી પાડે,
  - (એફ) ફરીયાદ, ફરીયાદીએ વ્યક્તિગત રીતે અથવા વકીલ સિવાયના અધિકૃત પ્રતિનિધિ ધ્વારા નોંધાવવામાં આવી હોય સિવાય કે એડવોકેટ પોતે વ્યથિત પક્ષકાર હોય.
2. આ સ્કીમ હેઠળ નીચેની બાબતોમાં સેવામાં ખામીની બાબતે કોઈ ફરીયાદ લાગુ પડશે નહીં.
- (એ) રેંયુલેટેડ એન્ટીટીનો કોમર્શીયલ ચુકાદો/કોમર્શીયલ નિર્ણય
  - (બી) આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટને સંબંધિત વેન્ડર અને રેંયુલેટેડ એન્ટીટી વચ્ચેની તકરાર
  - (સી) ઓમ્બડસમેનને સીધી રીતે સંબોધવામાં ન આવેલ હોય તેવી ફરીયાદ
  - (ડી) રેંયુલેટેડ એન્ટીટીના મેનેજમેન્ટ અથવા એક્ઝીક્યુટીવ સામે સામાન્ય ફરીયાદ
  - (ઇ) તકરાર કે જેમાં કાયદાકીય અથવા કાયદા અમલીકરણ અધિકારીના આદેશોનું પાલન કરીને રેંયુલેટેડ એન્ટીટી ધ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હોય
  - (એફ) એ સેવા જે રીજર્વ બેંકના નિયમનકારી કાર્યક્ષેત્રમાં ન હોય

જી) રેંયુલેટેડ એન્ટીટીઓ વચ્ચેનો વિવાદ

એચ) રેંયુલેટેડ એન્ટીટીના કર્મચારી—એમલોયર વચ્ચેની તકરાર

### ૩. ફરીયાદ દાખલ કરવાની પ્રક્રિયા

એ) ફરીયાદ <https://cms.rbi.org.in> ઉપર ઓનલાઈન નોંધાવી શકાય છે.

બી) ફરીયાદ ઈલેક્ટ્રોનિક અથવા ફીજીકલ મોડ ધ્વારા પણ રીજર્વ બેંક ધ્વારા સુચિત કર્યા મુજબ સેન્ટ્રલ રીસીપ્ટ અને પ્રોસેસીગ સેન્ટરમાં દાખલ કરી શકાય છે. ફરીયાદ, જો ભૌતિક સ્વરૂપમાં કરવામાં આવેલ હોય તો ફરીયાદી અથવા અધિકૃત પ્રતિનિધિએ તેના ઉપર યોગ્ય સહી કરવી જોઈશે. ફરીયાદ ઈલેક્ટ્રોનિક અથવા ફીજીકલ મોડમાં હોય તો તે રીજર્વ બેંકે નિયત કરેલ ફોર્મેટમાં અને જરૂરી માહિતી પૂરી પાડે તેવી હોવી જોઈએ.

### ૪. એપેલેટ ઓથોરીટી સમક્ષ અપીલ

ઓમ્બડસમેન(લોકપાલ) ઓફિસ ધ્વારા એવોર્ડ અથવા ફરીયાદને રદ કરવાથી નારાજ થયેલ ફરીયાદી એવોર્ડ મળ્યાની તારીખથી ૩૦ દિવસની અંદર એપેલેટ ઓથોરીટી સમક્ષ અપીલ કરી શકે છે. ફરીયાદી પાસે સમયમર્યાદાની અંદર અપીલ ન કરવા માટે પૂરતું અને યોગ્ય કારણ હોવા બાબતે જો એપેલેટ ઓથોરીટી સંતુષ્ટ હોય તો તે વધુ ૩૦ દિવસની મુદ્દત મંજૂર કરી શકે છે.

### ૫. ફરીયાદનું ફોર્મેટ <https://www.hdbfs.com/customer-support> ઉપર પુરં પાડવામાં આવેલ છે.